

પ્રોએક્ટીવ ડીસ્કલોગ્ર

કચેરીનું નામ:- કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, દેડિયાપાડા, જિ. નર્મદા

મુદ્દા નંબર :- ૧ પોતાના વ્યવસ્થાતંત્ર કાર્યો અને ફરજોની વિગત:-

કૃષિ વિજ્ઞાન કેન્દ્રએ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી તરફથી પ્રાપ્ય ૧૦૦ % ગ્રાન્ટથી ચાલતી "દ્રાન્સફર ઓફ ટેકનોલોજી" માટેની વિસ્તરણ શિક્ષણ યોજના છે. ભારત સરકારે દેશના તમામ રાજ્યોના પ્રત્યેક જિલ્લામાં એક કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કરવાનું નક્કી કરેલ છે, તે મુજબ હાલ ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં એક-એક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મંજૂર કરવામાં આવેલ છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રનું કાર્યક્રમે જે તે જિલ્લો હોય છે. કેન્દ્ર હેઠળ ચાલતી પ્રવૃત્તિઓ ઘનિષ્ઠતાથી હથ ધરી શકાય તે માટે જે તે જિલ્લાના ગ્રામોના જૂથ નક્કી કરીને છે. કેન્દ્ર હેઠળ ચાલતી પ્રવૃત્તિઓ ઘનિષ્ઠતાથી હથ ધરી શકાય તે માટે જે તે જિલ્લાના ગ્રામોના જૂથ નક્કી કરીને છે. કેન્દ્ર હેઠળ ચાલતી પ્રવૃત્તિઓ ઘનિષ્ઠતાથી હથ ધરી શકાય તે માટે જે તે જિલ્લાના ગ્રામોના જૂથ નક્કી કરીને છે. કેન્દ્ર હેઠળ ચાલતી પ્રવૃત્તિઓ ઘનિષ્ઠતાથી હથ ધરી શકાય તે માટે જે તે જિલ્લાના ગ્રામોના જૂથ નક્કી કરીને છે.

૧. સ્થાપનાનું વર્ષ	: ૧. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.યુ., દેડિયાપાડા (નર્મદા) ૨૦૦૭
૨. યોજનાનો પ્રકાર	: ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી (ભારત સરકાર)ની ૧૦૦ % ગ્રાન્ટથી ચાલતી "દ્રાન્સફર ઓફ ટેકનોલોજી" માટેની વિસ્તરણ શિક્ષણ યોજના છે.
૩. હેતુઓ/ઉદ્દેશો (Mandates)	<p>૧. ખેડૂતોને ગ્રામીણ યુવાનો માટે "કાર્ય દ્વારા શિક્ષણ" પર ભાર મુકીને કૃષિ અને સંલગ્ન વિષયો અંગે ટૂકાં તેમજ લાંબાગાળાના વ્યાવસાયિક તાલીમવર્ગો યોજીને સ્વરોજગારી વધારવાનો પ્રયત્ન કરવો.</p> <p>૨. નવીન કૃષિ તજશીતાઓ અંગે ખેડૂતોના પ્રતિભાવો જાણવા માટે ખેડૂતોના ખેતરો ઉપર વિવિધ પાકોના પ્રથમ હરોળના નિર્દર્શનો (Front line demonstrations) યોજવા.</p> <p>૩. સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ ટકાઉ ખેતી પદ્ધતિઓ વિકસાવવા સારુ નવી બહાર પાડવામાં આવતી કૃષિ તજશીતાઓની જુદી જુદી કૃષિ-આબોહવાકીય પરિસ્થિતિમાં યોગ્યતા અને અનુકૂળતા ચકાસવા માટે તથા ખેડૂતોને તે પ્રત્યક્ષ બતાવવા માટે ખેડૂતોના ખેતરો પર ક્ષેત્રિય-અભતરા (On-farm trials) નું આયોજન કરવું.</p> <p>૪. કૃષિ અને સંલગ્ન વિષયોના સંશોધનો સબંધી અધ્યતન માહિતી અંગે જે તે કાર્યક્રમ વિસ્તારના વિસ્તરણ કાર્યકરો/અધિકારીઓને જાણકારી આપીને નવીન તજશીતા અંગેના જ્ઞાનમાં વધારો કરવા માટે નિયમિત રીતે તાલીમ કાર્યક્રમો યોજવા.</p>

		૫. જીત્ખાનું કૃષિ સંલગ્ન જ્ઞાન કેન્દ્ર (Knowledge Centre) તરીકે વિકસાવવું.
૪. કામગીરી	:	<p>કૃષિ વિજ્ઞાન કેન્દ્રનું કાર્યક્ષેત્ર જે તે જિલ્લો હોય છે. કેન્દ્ર હેઠળ ચાલતી પ્રવૃત્તિઓ ઘનિષ્ઠતાથી હાથ ધરી શકાય તે માટે જે તે જિલ્લાના ગામોના જૂથ નક્કી કરીને ખેડૂતોને કૃષિ, પશુપાલન, મરધાં ઉછેર, મત્ત્યપાલન, ગૃહવિજ્ઞાન વિ. ની નવીન ટેકનોલોજીથી વાકેફ કરવા માટે કેન્દ્ર બહાર તથા કેન્દ્ર પર ચાર દિવસીય તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવે છે.</p> <p>કૃષિ તાંત્રિકીનો અસરકારક પ્રચાર અને પ્રસાર કરવા તથા કાર્યક્ષેત્ર હેઠળના ખેડૂતો સાથે સતત સંપર્ક જાળવી રાખવા માટે કેન્દ્ર દ્વારા ખેડૂતદિન, ખેડૂતશાખિર, ફિલટ્રીપ, પદ્ધતિ નિર્દર્શનો, કૃષિપ્રદર્શન, કૃષિમેળો, ફિલમશો વિ. વિસ્તરણ પ્રવૃત્તિઓનું સમયાંતરે આયોજન કરવામાં આવે છે.</p> <p>ખેડૂતોના ખેતરે અગ્રીમ હરોળ નિર્દર્શનો ગોઠવી નવી તાંત્રીકતાઓ ખેડૂતોના ખેતરે સુધી પહોંચાડવામાં આવે છે. સંલગ્ન વિભાગોનાં તાંત્રીક મહેકમને આધુનિક સંશોધનથી માહિતગાર કરવા તેઓને માટે ખાસ રીફરેશર તાલીમો આપવામાં આવે છે. કૃષિ સંલગ્ન વ્યવસાયને લગતી વ્યવસાયિક તાલીમો આપવામાં આવે છે.</p>

મુદ્રા નંબર :— ૨ કે.વિ.કે., ન.કુ.યુ., હેઠળ ફરજ બજાવતા તાંત્રિક અધિકારીશ્રી /કર્મચારીઓ માટે કામગીરી વહેંચણી

(૧) ડૉ. વી. કે. પોશીયા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા (ઈ.ચા.)

૧	હેડ ઓફ યુનિટ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તથા હિસાબી વહીવટી કામગીરીની તમામ દેખરેખ તથા તાંત્રિક માર્ગદર્શન અને નિયંત્રણ.
૨	શિક્ષણ અને વિસ્તરણની કેન્દ્ર ખાતેની યોજનાઓનું આયોજન અને અમલની કામગીરી.
૩	યુનિવર્સિટી કક્ષાની તથા મા. સરકારશ્રીની વખતો વખત ની બેઠકોમાં હાજરી આપવી.
૪	યુનિ. અધિકારી તરીકે બધી યોજના (આયોજીત, બીનઆયોજીત, અન્ય) ની જવાબદારી નિભાવણી.
૫	ડાયરેક્ટર ATARI, મા. કુલપતિશ્રી, તથા મા.વિસ્તરણ શિક્ષણનિયામકશ્રી સાથે પત્ર વ્યવહાર તથા રીપોર્ટિંગની કામગીરી.
૬	કેન્દ્ર ખાતેની બધી વિસ્તરણ યોજનાનું સંચાલન કરી કેન્દ્રને આદિવાસીભિમુખ બનાવવું.
૭	કેન્દ્ર ખાતે ચાલતી સમગ્ર પ્રવૃત્તિઓનું આયોજન, સંકલન અને કેન્દ્રનું વહીવટી સંચાલન.
૮	યુનિવર્સિટીની વડી કચેરી દ્વારા વખતો-વખત સોંપવામાં આવતી તમામ પ્રકારની કામગીરી.

(२) ખાતી જગ્યા, વૈજ્ઞાનિક, (વિસ્તરણ) (ટી - ૧)

૧	પસંદ કરેલ ગામોમાં PRA/ Benchmark Survey/ Need Assessment / Identification of Thrust area સંબંધી કામગીરી.
૨	વિસ્તરણ શિક્ષણ વિષયક તાલીમ કાર્યક્રમોનું આયોજન, સંકલન અને અમલીકરણ તથા તત્ત્વબંધી ફાઈલ/ રેકૉર્ડની જાળવણી.
૩	આકાશવાણી, દૂરદર્શન, પ્રાઇવેટ ચેનલો કૃષિ વિષયક લેખો વિ. સંબંધી પત્રવ્યવહાર અને ફાઈલો નિભાવવાની કામગીરી.
૪	સેમિનાર/ વર્કશોપ/ પરિસંવાદ / કોન્ફરન્સ /વ્યાખ્યાન / તાંત્રિક ચુપ મિટિંગ વિ. નું આયોજન, સંકલન, અમલ અને પત્રવ્યવહાર.
૫	વિસ્તરણ શિક્ષણ પરિષદ તથા નિયામક મંડળની બેઠક માટે જરૂરી તાંત્રિક માહિતી અને મુદ્દાનોંધ તૈયાર કરવી.
૬	કચેરીમાં તાંત્રિક માહિતી અને ખેડૂતોપયોગી સાહિત્યની ડિસ્પ્લે સિસ્ટમ ગોઠવવી. નેઇમ પ્લેટ, સાઈન બોર્ડ, વિ. તૈયાર કરવાની કામગીરી.
૭	વિસ્તરણ શિક્ષણ સંબંધી નવી યોજનાઓની દરખાસ્તની કામગીરી.
૮	કૃષિ વિજ્ઞાન કેન્દ્રની પ્રવૃત્તિઓનું સમયાંતરે Impact Assessment કરવું.
૯	યુનિવર્સિટી, જિલ્લા / ટ્રાયબલ સબાલાન, સંકલન સરકારી / સહકારી / સ્વૈચ્છક સંસ્થાઓ, જોનલ કોઓર્ડિનેટર અને સાથેપત્રવ્યવહાર અને ICAR ફાઈલોની જાળવણી.
૧૦	શ્રેષ્ઠ કેવીકે એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ, અસ્પી એવોર્ડ, ITK એવોર્ડ વિ. એવોર્ડસ, સંબંધી કામગીરી અને પત્રવ્યવહાર કરવો.
૧૧	દર માસે પ્રથમ વીકમાં સ્ટાફ મિટિંગનું આયોજન કરવું.
૧૨	કૃષિ પ્રદર્શનની કામગીરી ટી-૧૧ સાથે રહી કરવી.
૧૩	વિષયને લગતી ખરીદીની કામગીરી કરવી.
૧૪	ATMA પ્રોજેક્ટ સંબંધી પત્રવ્યવહાર અને ફાઈલ નિભાવવાની કામગીરી.
૧૫	સૌપેલ કલ્સટરમાં કેવીકેની દરેક વિષયની પ્રવૃત્તિઓ થાય તે અંગે આયોજન કરવું.
૧૬	વિષયને લગતાં નવા અખતરાઓ તૈયાર કરી AGRESCO માં મંજૂર કરાવી ફામ પર આયોજન કરી તેમજ તેના પરિણામોની રજુઆત કરવી.
૧૭	કેન્દ્ર તથા યુનિટના વડા વખતોવખત સૌપે તે કામગીરી.

(૩) ખાતી જગ્યા, વૈજ્ઞાનિક, (એચોનોમી) (ટી-૨)

૧	કેવીકે ફાર્મના અખતરાં, નિદર્શન પ્લોટ, ટેમોન્સ્ટ્રેશન યુનિટ તથા પાક કૌતુકાલય, મ્યુઝીયમ તૈયાર કરવાની કામગીરી.
૨	કેવીકેના મેન્ડેટલક્ષી પ્રથમ હરોળના નિદર્શનો (FLD) અને ફોર્મ પરના અખતરા (OFT) સંબંધી કામગીરી. આ માટે જરૂરી ઈનપુટની ખરીદી અને વિતરણ સંબંધી પત્રવ્યવહાર/ રજીસ્ટરો/ ફાઈલોની જાળવણી.
૩	એચોનોમી વિષયક તાલીમ કાર્યક્રમોનું આયોજન, સંકલન અને અમલીકરણ સંબંધી ફાઈલોની જાળવણી.

૪	ZREARC અને AGRESCO માં એગ્રોનોમી વિષયના પ્રથમ હરોળના નિર્દર્શનો (FLD) અને ફાર્મ પરના અખતરાં (OFT) નો તાંત્રિક કાર્યક્રમ મંજૂર કરાવવો તથા રિઝલ્ટના આંકડાની રજૂઆત કરવી.
૫	એગ્રોનોમી વિષયક નવી યોજનાઓની દરખાસ્ત કરવાની કામગીરી.
૬	વિષયને લગતી સફળ વાર્તા / કેસ સ્ટડી તૈયાર કરીને યોગ્યજગ્યા અને સમયે તેની લેખિત અને મૌખિક રજૂઆત કરવી.
૭	કેવીકે ફાર્મનું મોનીટરીંગ કરી એમ મેનેજરને માર્ગદર્શન આપવું.
૮	સોપેલ કલ્સટરમાં કેવીકેની દરેક વિષયની પ્રવૃત્તિઓ થાય તે અંગે આયોજન કરવું.
૯	NMOOP, NFSM, NRCG, DGR યોજનાઓને લગતીસંપૂર્ણ કામગીરી.
૧૦	દ્રાયબલ સબ પ્લાન યોજનાને લગતી તમામ કામગીરી.
૧૧	વિષયને લગતી ખરીદીની કામગીરી કરવી.
૧૨	વિષયને લગતાં નવા અખતરાઓ તૈયાર કરી AGRESCOમાં મંજૂર કરાવી ફાર્મ પર આયોજન કરી તેમજ તેના પરિણામોની રજૂઆત કરવી.
૧૩	વિષયને લગતી પ્રવૃત્તિઓ કેવીકે પોર્ટલ પર અપટેટ કરવી.
૧૪	કેવીકે ફાર્મનું મોનીટરીંગ કરી ફાર્મ મેનેજરને માર્ગદર્શન આપવું.
૧૫	વર્મિ કમ્પોસ્ટ યુનિટને લગતી સંપૂર્ણ કામગીરી.
૧૬	કેન્દ્ર તથા યુનિટના વડા વખતોવખત સોપે તે કામગીરી.

(૪) ખાલી જગ્યા, વૈજ્ઞાનિક (બાગાયત) (ટી-૩)

૧	કેવીકે ફાર્મમાં બાગાયતી પાકોના નિર્દર્શન પ્લોટ તથા પાક કોન્ટુકાલય તૈયાર કરવાની કામગીરી.
૨	બાગાયતી પાકોના પ્રથમ હરોળના નિર્દર્શનો (FLD) અને ફાર્મ પરના અખતરાં (OFT) સંબંધી કામગીરી.
૩	બાગાયતી વિષયક તાલીમ કાર્યક્રમોનું આયોજન, સંકલન અને અમલીકરણ તથા તત્સંબંધી ફાઈલો / રેકડની જાળવણી.
૪	ZREARC અને AGRESCO માં બાગાયતી વિષયના પ્રથમ હરોળના નિર્દર્શનો (FLD) અને ફાર્મ પરના અખતરાં (OFT) નો તાંત્રિક કાર્યક્રમ મંજૂર કરાવવો તથા રિઝલ્ટના આંકડાની રજૂઆત કરવી.
૫	કેવીકે ફાર્મ પર શ્રીન હાઉસ, નર્સરીઓના કરી તેને લગતી પ્રવૃત્તિઓની કામગીરી.
૬	કેવીકે ફાર્મમાં ફળપાકો / શાકભાજી પાકોની નર્સરી કાર્યરત કરવી.
૭	બાગાયતી વિષયક નવી યોજનાઓની દરખાસ્તની કામગીરી.
૮	રિવોલ્વિંગ ફંડમાં આવક વધે તેવી બાગાયતલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન, સંકલન અને તે સંબંધી કામગીરી.
૯	વિષયને લગતી સફળ વાર્તા / કેસ સ્ટડી તૈયાર કરીને યોગ્યજગ્યા અને સમયે તેની લેખિત અને મૌખિક રજૂઆત કરવી.
૧૦	NHM પ્રોજેક્ટને લગતી તમામ કામગીરી.
૧૨	વિષયને લગતી ખરીદીની કામગીરી કરવી.
૧૩	કેન્દ્રની સુંદરતા વધારવા માટે ગાર્ડનીંગ, લેન્ડસ્કેપીંગ, પ્લાન્ટેશન વગેરેની કામગીરી.
૧૪	સોપેલ કલ્સટરમાં કેવીકેની દરેક વિષયની પ્રવૃત્તિઓ થાય તે અંગે આયોજન કરવું.

૪	ZREARC અને AGRESCO માં એગ્રોનોમી વિષયના પ્રથમ હરોળના નિર્દર્શનો (FLD) અને ફાર્મ પરના અખતરાં (OFT) નો તાંત્રિક કાર્યક્રમ મંજૂર કરાવવો તથા રિઝલ્ટના આંકડાની રજૂઆત કરવી.
૫	એગ્રોનોમી વિષયક નવી યોજનાઓની દરખાસ્ત કરવાની કામગીરી.
૬	વિષયને લગતી સફળ વાર્તા / કેસ સ્ટડી તૈયાર કરીને યોગ્યજગ્યા અને સમયે તેની લેખિત અને મૌખિક રજૂઆત કરવી.
૭	કેવીકે ફાર્મનું મોનીટરીંગ કરી એમ મેનેજરને માર્ગદર્શન આપવું.
૮	સોંપેલ કલ્સટરમાં કેવીકેની દરેક વિષયની પ્રવૃત્તિઓ થાય તે અંગે આયોજન કરવું.
૯	NMOOP, NFSM, NRCG, DGR યોજનાઓને લગતીસંપૂર્ણ કામગીરી.
૧૦	ટ્રાયબલ સબ પ્લાન યોજનાને લગતી તમામ કામગીરી.
૧૧	વિષયને લગતી ખરીદીની કામગીરી કરવી.
૧૨	વિષયને લગતાં નવા અખતરાઓ તૈયાર કરી AGRESCOમાં મંજૂર કરાવી ફાર્મ પર આયોજન કરી તેમજ તેના પરિણામોની રજૂઆત કરવી.
૧૩	વિષયને લગતી પ્રવૃત્તિઓ કેવીકે પૌર્ટલ પર અપડેટ કરવી.
૧૪	કેવીકે ફાર્મનું મોનીટરીંગ કરી ફાર્મ મેનેજરને માર્ગદર્શન આપવું.
૧૫	વર્મિ કમ્પોસ્ટ યુનિટને લગતી સંપૂર્ણ કામગીરી.
૧૬	કેન્દ્ર તથા યુનિટના વડા વખતોવખત સોંપે તે કામગીરી.

(૪) ખાલી જગ્યા, વૈજ્ઞાનિક (બાગાયત) (૩૧-૩)

૧	કેવીકે ફાર્મમાં બાગાયતી પાકોના નિર્દર્શન પ્લોટ તથા પાક કૌતુકાલય તૈયાર કરવાની કામગીરી.
૨	બાગાયતી પાકોના પ્રથમ હરોળના નિર્દર્શનો (FLD) અને ફાર્મ પરના અખતરાં (OFT) સંબંધી કામગીરી.
૩	બાગાયતી વિષયક તાલીમ કાર્યક્રમોનું આયોજન, સંકલન અને અમલીકરણ તથા તત્સંબંધી ફાઈલો / રેકડની જાળવણી.
૪	ZREARC અને AGRESCO માં બાગાયતી વિષયના પ્રથમ હરોળના નિર્દર્શનો (FLD) અને ફાર્મ પરના અખતરાં (OFT) નો તાંત્રિક કાર્યક્રમ મંજૂર કરાવવો તથા રિઝલ્ટના આંકડાની રજૂઆત કરવી.
૫	કેવીકે ફાર્મ પર શીન હાઉસ, નર્સરીઓભા કરી તેને લગતી પ્રવૃત્તિઓની કામગીરી.
૬	કેવીકે ફાર્મમાં ફળપાકો / શાકભાજી પાકોની નર્સરી કાર્યરત કરવી.
૭	બાગાયતી વિષયક નવી યોજનાઓની દરખાસ્તની કામગીરી.
૮	રિવોલ્વિંગ ફંડમાં આવક વધે તેવી બાગાયતલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન, સંકલન અને તે સંબંધી કામગીરી.
૯	વિષયને લગતી સફળ વાર્તા / કેસ સ્ટડી તૈયાર કરીને યોગ્યજગ્યા અને સમયે તેની લેખિત અને મૌખિક રજૂઆત કરવી.
૧૦	NHM પ્રોજેક્ટને લગતી તમામ કામગીરી.
૧૨	વિષયને લગતી ખરીદીની કામગીરી કરવી.
૧૩	કેન્દ્રની સુંદરતા વધારવા માટે ગાઈનીગ, લેન્ડસ્કેપીંગ, પ્લાન્ટેશન વગેરેની કામગીરી.
૧૪	સોંપેલ કલ્સટરમાં કેવીકેની દરેક વિષયની પ્રવૃત્તિઓ થાય તે અંગે આયોજન કરવું.

૧૫	વિષયને લગતાં નવા અખતરાઓ તૈયાર કરી AGRESCOમાં મંજૂર કરાવી ફાર્મ પર આયોજન કરી તેમજ તેના પરિણામોની રજૂઆત કરવી.
૧૬	વિષયને લગતી પ્રવૃત્તિઓ કેવીકે પોર્ટલ પર અપડેટ કરવી.
૧૭	ફેન એન્ડ પેડ શ્રીન હાઉસ તેમજ નેટ હાઉસને લગતી સંપૂર્ણ કામગીરી.
૧૮	૩૧-૧૦ નો સંપૂર્ણ ચાર્જ સંભાળવો.
૧૯	કેન્દ્ર તથા યુનિટના વડા વખતોવખત સોએ તે કામગીરી.

(૫) ડૉ. શૈલેષકુમાર અને. ગજજર, વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ) (પુલના ધોરણે – કોલેજ ઓફ ફોરેસ્ટ્રી, નવસારી) (૩૧-૪)

૧	કેવીકે ફાર્મમાં પાકોના અખતરાં, નિર્દર્શન પ્લોટ તથા પાકમાં પાક સંરક્ષણ કામગીરી.
૨	પાકના પ્રથમ હરોળના નિર્દર્શનો (FLD) અને ફાર્મ પરના અખતરાં (OFT) સંબંધી કામગીરી.
૩	પાક સંરક્ષણ વિષયક તાલીમ કાર્યક્રમોનું આયોજન, સંકલન અને અમલીકરણ તથા તત્ત્વસંબંધી ફાઈલો / રેકડની જાળવણી.
૪	ZREARC અને AGRESCO માં પાક સંરક્ષણવિષયના પ્રથમ હરોળના નિર્દર્શનો (FLD) અને ફાર્મ પરના અખતરાં (OFT) નો તાંત્રિક કાર્યક્રમ મંજૂર કરાવવો તથા રિઝલ્ટના આંકડાની રજૂઆત કરવી.
૫	પાક સંરક્ષણ નવી યોજનાઓની દરખાસ્તન કામગીરી.
૬	વિષયને લગતી સફળ વાર્તા / કેસ સ્ટડી તૈયાર કરીને યોગ્યજગ્યા અને સમયે તેની લેખિત અને મૌખિક રજૂઆત કરવી.
૭	વિષયને લગતી ખરીદીની કામગીરી કરવી.
૮	કેવીકે ફાર્મનું મોનીટરીંગ કરી પાકસંરક્ષણ સંબંધી ફાર્મ મેનેજરને માર્ગદર્શન આપવું.
૯	સોએલ કલ્સટરમાં કેવીકેની દરેક વિષયની પ્રવૃત્તિઓ થાય તે અંગે આયોજન કરવું.
૧૦	વિષયને લગતાં નવા અખતરાઓ તૈયાર કરી AGRESCOમાં મંજૂર કરાવી ફાર્મ પર આયોજન કરી તેમજ તેના પરિણામોની રજૂઆત કરવી.
૧૧	કચેરીના વડાની ગેરહાજરીમાં કચેરી/ ફાર્મ વ્યવસ્થાની દેખરેખ રાખવી.
૧૨	વિષયને લગતી પ્રવૃત્તિઓ કેવીકે પોર્ટલ પર અપડેટ કરવી.
૧૩	મશરૂમ યુનિટને લગતી સંપૂર્ણ કામગીરી.
૧૪	જિલ્લા સંકલનને લગતી સંપૂર્ણ કામગીરી.
૧૫	MGMG, Adaptive, AICRP- COTTON ને લગતી સંપૂર્ણ કામગીરી.
૧૬	સોએલ ટેસ્ટીંગ લેબોરેટરીને લગતી તમામ કામગીરી.
૧૭	એસ્પીરેશન નર્મદા વિભાગને લગતી સંપૂર્ણ કામગીરી.
૧૮	કેન્દ્ર તથા યુનિટના વડા વખતોવખત સોએ તે કામગીરી.

(૬) ડૉ. દી. બી. ભાસરા, વૈજ્ઞાનિક, (પશુ પાલન) (ટી-૫)

૧	કેવીકે ખાતે પશુપાલન સંબંધી નિર્દર્શનો અને કાર્યક્રમો.
૨	પશુપાલનના FLD, OFTની કામગીરી.
૩	પશુ પાલનવિષયક તાલીમ કાર્યક્રમાનું આયોજન, સંકલન અને અમલીકરણ તથા તત્ત્વસંબંધી ફાઈલો / રેકડની જાળવણી.
૪	ZREARC અને AGRESCO માં પશુપાલનવિષયના પ્રથમ હરોળના નિર્દર્શનો (FLD) અને ફાર્મ પરના અખતરાં (OFT) નો તાંત્રિક કાર્યક્રમ મંજૂર કરાવવો તથા રિઝલ્ટના આંકડાની રજૂઆત કરવી.
૫	પશુપાલન વિષયક નવી યોજનાઓની દરખાસ્ત કરવાની કામગીરી.
૬	વિષયને લગતી ખરીદીની કામગીરી કરવી.
૭	સૌંપેલ કલ્સટરમાં કેવીકેની દરેક વિષયની પ્રવૃત્તિઓ થાય તે અંગે આયોજન કરવું.
૮	વિષયને લગતાં નવા અખતરાઓ તૈયાર કરી AGRESCOમાં મંજૂર કરાવી ફાર્મ પર આયોજન કરી તેમજ તેના પરિણામોની રજૂઆત કરવી.
૯	વિષયને લગતી પ્રવૃત્તિઓ કેવીકે પોર્ટલ પર અપદેટ કરવી.
૧૦	બાયોગેસ યુનિટ, અઝોલાયુનિટ તેમજ બકરા યુનિટની સંપૂર્ણ કામગીરી.
૧૧	ટી-૩ અને ટી-૧૦ નો સંપૂર્ણ ચાર્જ સંભાળવો.
૧૨	કેન્દ્ર તથા યુનિટના વડા વખતોવખત સૌંપે તે કામગીરી.

(૭) ડૉ. મીનાક્ષીબેન વી. તિવારી, વૈજ્ઞાનિક (ગૃહવિજ્ઞાન) (ટી-૬)

૧	કેવીકે ગૃહવિજ્ઞાનને લગતી વિવિધ તાલીમ કાર્યક્રમાનું આયોજન, સંકલન અને અમલીકરણ તથા સંબંધી ફાઈલો / રેકડની જાળવણી.
૨	મહિલા વિકાસને લગતા વિવિધ કાર્યક્રમો / સેમિનાર / મહિલા શિબિર તથા વર્કશોપનું આયેજન સંચાલન તેમજ અમલીકરણ કરવું.
૩	વિષય નિષ્ણાંતને તાંત્રિક કામગીરીમાં મદદરૂપ થવું.
૪	ગૃહવિજ્ઞાનને સંબંધી FLD નું આયોજન કરવું.
૫	સૌંપેલ કલ્સટરમાં કેવીકેની દરેક વિષયની પ્રવૃત્તિઓ થાય તે અંગે આયોજન કરવું.
૬	રીવ્યુ મીટિંગને લગતી કામગીરી કરવી.
૭	વિષયને લગતી પ્રવૃત્તિઓ કેવીકે પોર્ટલ પર અપદેટ કરવી.
૮	વિષયને લગતી ખરીદીની કામગીરી કરવી.
૯	સ્વચ્છતા અભિયાનને લગતી સંપૂર્ણ કામગીરી કરવી.
૧૦	લાઇબ્રેરીની સંપૂર્ણ કામગીરી.
૧૧	NICRA પ્રોજેક્ટ ને લગતી વિવિધ તાલીમ કાર્યક્રમાનું આયોજનલ સંકલન અને અમલીકરણ તથા સંબંધી ફાઈલો/રેકોડની જાળવણી
૧૨	Adaptive trial ને લગતી સંપૂર્ણ કામગીરી
૧૩	વિષયને લગતા અખતરાઓ તૈયાર કરી અન્નેસ્કો મા મુકવું

૧૪	વિષયને લગતી નિર્દર્શન એકમ જેવા કી ફાર્મ મૈકેનાઈજેશન અને કિયનગાર્ડન ની મોનીટરીંગ કરવું
૧૫	વિષયને લગતી સફળ વાર્તા અને કેસ સ્ટડી તૈયાર કરવું
૧૬	વિષયને લગતી લેખ અને પ્રકાશન તૈયાર કરવું અને કેવીકે ને લગતી મેનડેટરી કામગીરી કરવું
૧૭	કેન્દ્ર તથા યુનિટના વડા વખતોવખત સૌપે તે કામગીરી.

(૮) શ્રી. એમ. એલ. વિસાત, ફાર્મ મેનેજર(ટી-૭)

૧	કેવીકે ફાર્મના ફાર્મના મેનેજર તરીકે સંપૂર્ણ જવાબદારી નિભાવવી.
૨	ફાર્મની તમામ ખરીદી તથા તમામ રેકૉર્ડ્સ નિભાવવા.
૩	મજૂર મસ્ટર ચેક કરવાની જવાબદારી.
૪	કેવીકેની પાક યોજનાઓની મંજૂરીની કામગીરી.
૫	ફાર્મને લગતા તમામ ફાઈલો તથા પત્રવ્યવહારની કામગીરી.
૬	કે.વિ.કે. ફાર્મનાં અખતરા, નિર્દર્શન પ્લોટ, ડેમોસ્ટ્રેશન યુનિટ તથા પાક કૌતુકાલય, પાક મ્યુઝિયમના આયોજન તેમજ દેખરેખમાં વિષય નિષ્ણાંતોને મદદરૂપ થવું.
૭	ટી-૧૨ ની કામગીરી કરવી.
૮	કેન્દ્ર તથા યુનિટના વડા વખતોવખત સૌપે તે કામગીરી.

(૯) શ્રી. વી. આર. જીજાળા, ટ્રેનિંગ આસિસ્ટન્ટ(ટી-૮)

૧	મંજૂરી કન્જયુમર / સ્ટોર રોજમેળ તમામ સ્ટિકમના રજીસ્ટર નિભાવવા તથા જાળવણી કરવી તમામ રેકૉર્ડ્સ જાળવવા.
૨	ખરીદી અંગેની તમામ કામગીરી.
૩	વિષય નિષ્ણાંતને તાંત્રિક કામગીરીમાં મદદરૂપ થવું.
૪	ટી-૧ થી ટી-૭ સુધીના તમામને ખરીદીની કામગીરીમાં મદદરૂપ થવું.
૫	કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સમગ્ર પ્રવૃત્તિઓ / કાર્યક્રમોનું મધ્યસ્થ નોંધણી રજીસ્ટર નિભાવવું, ડોક્યુમેન્ટેશન કરવું તથા સિદ્ધિઓના રેકૉર્ડની જાળવણી.
૬	વૈજ્ઞાનિક સલાહકાર સમિતિ (SAC) અને ZREARCની બેઠકનું આયોજન, મુદ્દાનોંધ, કાર્યનોંધ વિ. તમામ કામગીરી.
૭	કૃષિ વિજ્ઞાન કેન્દ્રના માસિક / ત્રિમાસિક / વાર્ષિક અહેવાલ તૈયાર કરવા તથા સમયાંતરે સબંધિતને મોકલવાની કામગીરી.
૮	કૃષિ સાહિત્ય પ્રકાશનને લગતી કામગીરી.
૯	વિષયને લગતી સફળ વાર્તા / કેસ સ્ટડી/ઇમ્પેક્ટ સ્ટડી તૈયાર કરીને યોગ્ય જગ્યા અને સમયે તેની લેખિત તથા મૌખિક રજૂઆત કરવી.
૧૦	પ્રેસનોટ, પત્રકાર પરિષદ, પ્રેસનોટ પ્રસિદ્ધિ, તથા ટેનિકિપત્રમાં પ્રસિદ્ધિ, થયેલ પ્રેસનોટનું નિયમિત કટિંગ કરીને ફાઈલો નિભાવવાની કામગીરી કરવી.
૧૧	કેન્દ્રની IT ને લગતી ખરીદી, કચેરીની વેબસાઈટ, પોર્ટલ અપડેટ કરવું, ઓન લાઈન મિટિંગ, સેમિનાર,

	વર્કશોપનું એરેન્જમેન્ટ કરવું તેમજ ટેન્ડર, પરિપત્ર અને અન્ય માહિતી NAU.IN પર અપલોડ કરવી.
૧૨	ફાર્મ પર લેવામાં આવતા અખતરાઓ, નિર્દર્શનો અને બીજ ઉત્પાદની કામગીરી.
૧૩	કેવીકે ફાર્મના ફાર્મના મેનેજર તરીકે સંપૂર્ણ જવાબદારી નિભાવવી.
૧૪	દરેક વિષય નિષ્ણાંત પાસેથી નિર્ધારિત પ્રકોર્મમાં થયેલ પ્રવૃત્તિની માહિતી ભેગી કરી ફાઈલ બનાવવી.
૧૫	કેવીકેની વિસ્તરણને લગતી તમામ પ્રવૃત્તિઓ કેવીકે પોર્ટલ પર અપડેટ કરવી.
૧૬	કેન્દ્ર તથા યુનિટના વડા વખતોવખત સોંપે તે કામગીરી.

(૧૦) શ્રી. એન. જે. વ્યાસ, કચેરી અધિકારી (અ-૧) (પુલના ધોરણે – COA, ભરુચ)	
૧	કચેરી સંલગ્ન તમામ વહિવટ રેકોર્ડસની નિભાવવી જાળવણી કરવી.
૨	તમામ કર્મચારીઓની સર્વિસ બુક, પર્સનલ પી.એફ./ સી.પી. એફ.બુક/ ફાઈલો તથા સી.આર.ના રેકોર્ડસ રાખવા.
૩	તમામ નાણાંકીય વ્યવહાર ICAR / યુનિ. તથા અધર એજન્સી સાથે જાળવવા તથા તે સંબંધી રેકોર્ડસ નિભાવવા.
૪	કચેરીની સ્ટેશનરી ખરીદી, રીકરીંગ / નોન રીકરીંગ, ટેડસ્ટોક ખરીદીની કાર્યવાહીની દેખરેખ રાખવી.
૫	કચેરીના તમામ બજેટ સદરોની કેશબુક લખવાની કામગીરી તથા કેવીકે સિવાયનાં તમામ બ.સ.નાં બજેટ બનાવવાની કામગીરી તથા ખર્ચ – આવક તથા રીટેઇલ રજીસ્ટરો નિભાવવાની કામગીરી.
૬	ડીમાન્ડ ઓફ ફંડ AUC કેશબુક (જનરલ તથા રિવોલ્વિંગ ફંડ), પગાર બીલ/ પગાર/મથ્થાં / ટીએ બીલ, એબસ્ટેક્ટ બીલ, પી.એ.ડી.એ./ એન.પી.ડી.સી. બીલ બનાવવા, અન્ય તમામ નાણાંકીય વ્યવહાર નિભાવવા તથા તેને સંબંધિત જરૂરી ફોર્મ્સ / રજીસ્ટર રેકોર્ડ રાખવા.
૭	કચેરીના તમામ હિસાબો વખતોવખત ફોમ્ટોલરશી ની કચેરી ખાતે મેળવવા તથા ICAR / યુનિ. સાથે નાણાંકીય બાબતે પત્રવ્યવહાર જાળવવો.
૮	યુનિ. ખાતેથી મળવાપાત્ર તમામ સ્ટેશનરી / રજીસ્ટરો / રેકોર્ડસ / ફોર્મ્સ મેળવવા તથા તેની જાળવણી કરવી. અને કર્મચારી / અધિકારીની માંગ મુજબ પુરા પરા પાડવા.
૯	કેન્દ્ર તથા યુનિટના વડા વખતોવખત સોંપે તે કામગીરી.
નોંધ	સદર કામગીરી શ્રી. જે. ડી. ચૌધરી, જુનીયર કલાર્ક CAET, દેઝિયાપાડાને (પુલના ધોરણે કે.વિ.કે., દેઝિયાપાડા) સોંપવામાં આવેલ છે.

(૧૧) ખાલી જગ્યા (સ્ટેનોગ્રાફર) (અ-૨)	
૧	કચેરીના તમામ પત્રવ્યવહારનું ગુજરાતી / અંગ્રેજી ટાઈપીગ કરવું.
૨	કેન્દ્રના કર્મચારીઓની અંગત કોન્ફિડેન્શીલ માહિતીનું ટાઈપીગ / ફાઈલીગ તથા સંબંધીત તમામ રેકોર્ડસ રાખવા.
૩	કચેરીના તમામ પત્રવ્યવહારનું ઈનવર્ડ / આઉટવર્ડ ની કામગીરી સંભાળવી તથા તેના રજીસ્ટર જાળવવા.
૪	કેન્દ્ર તથા યુનિટના વડા વખતોવખત સોંપે તે કામગીરી.

(૧૨) શ્રી. એમ.એચ.ભણી, કોમ્પ્યુટર પ્રોગ્રામર (એ-૩) (પુલના ધોરણે – આઈટી સેલ નવસારી)

નોંધ સદર કામગીરી શ્રી. વી. આર. જીજાળા, ટ્રેનિંગ આસિસ્ટન્ટ સોપવામાં આવેલ છે.

(૧૩) ડૉ. વી. કે. પોશીયા, મદદનીશ પ્રાધ્યાપક, આદિવાસી મહિલા તાલીમ કેન્દ્ર (ટી-૬)

૧	આદિવાસી મહિલા તાલીમ કેન્દ્રની તાલીમ, નિર્દર્શનો અને વિસ્તરણને લગતી તમામ પ્રવૃત્તિઓની કામગીરી.
૨	યોજનાકીય ખરીદી, વપરાશ, તથા અન્ય રજીસ્ટરો નીભાવવાની કામગીરી.
૩	યોજનાકીય કામગીરીના રીપોર્ટિંગની કામગીરી.
૪	ZREARC અને AGRESKO માં વિસ્તરણાવિષયની તાલીમો, નિર્દર્શનો, તાંત્રિક કાર્યક્રમ મંજૂર કરાવવો તથા રિઝલ્ટના આંકડાની રજૂઆત કરવી.
૫	ટી-૧,૨,૪ નો સંપૂર્ણ ચાર્જ સંભાળવો.
૬	હોસ્ટેલની સાફ સફાઈ તથા રેકર્ડની જાળવણી કરાવવી.
૭	કેન્દ્ર તથા યુનિટના વડા વખતોવખત સોંપે તે કામગીરી.

(૧૪) ખાલી જગ્યા, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક (ટી-૧૦)

૧	કેવીકે ફાર્મના દેખરેખ રાખી ફાર્મ મેનેજર તથા ખેતી મદદનીશને કામગીરી અંગે માર્ગદર્શન આપવું.
૨	ફાર્મની તમામ ખરીદી ટી-૭ સાથે રહી કરવી.
૩	મંજૂર મસ્ટર ચેક કરવાની જવાબદારી.
૪	કેવીકે ખાતેના પ્લાન્ટ બ્રીડિંગના અખતરાની પાક યોજનાઓની મંજૂરીની કામગીરી.
૫	અન્યકેન્દ્ર પરથી આવતા પ્લાન્ટ બ્રીડિંગના અખતરાઓની ગોઠવણી, અવલોકનો લેવા તથા પરિણામો તૈયાર કરી જે તે કચેરીને મોકલવાની કામગીરી.
૬	ફાર્મને લગતા તમામ ફાઈલો તથા પત્રવ્યવહારની કામગીરી.
૭	કેન્દ્ર તથા યુનિટના વડા વખતોવખત સોંપે તે કામગીરી.

(૧૫) ખાલી જગ્યા, ખેતીવાડી અધિકારી, (ટી-૧૧)

૧	કેવિકે ફાર્મની દેખરેખ રાખવી તથા ખેતીમદદનીશને કામગીરી અંગે માર્ગદર્શન આપવું.
૨	ફાર્મ પર લેવામાં આવતા અખતરાઓ, નિર્દર્શનો અને બીજ ઉત્પાદનની કામગીરી ટી-૧૦ ના માર્ગદર્શન મુજબ કરવી.
૩	મંજૂર મસ્ટર ચેક કરવાની જવાબદારી.
૪	કેવીકેની કચેરીના મ્યુઝિયમની દેખરેખની કામગીરી.
૫	કે.વિ.કે. ફાર્મનાં અખતરા, નિર્દર્શન પ્લોટ, ટેમોસ્ટ્રેશન યુનિટ તથા પાક કૌતુકાલય, પાક મ્યુઝિયમના આયોજન તેમજ દેખરેખમાં વિષય નિષ્ણાંતોને મદદરૂપ થવું.
૬	કૃષિ પ્રદર્શન સ્ટોલની કામગીરી.
૭	ટી-૧૨ ની કામગીરી કરવી.
૮	કેન્દ્ર તથા યુનિટના વડા વખતોવખત સોંપે તે કામગીરી.

નોંધ

સદર ઉપરોક્ત કામગીરી શ્રી. એમ. એલ. વિસાત, ફાર્મ મેનેજર અને શ્રી. વી. આર. જીજાળા, ટ્રેનિંગ આસિસ્ટન્ટ સયુક્તપણે કામગીરી કરે છે.

(૧૬) ખાલી જગ્યા, ખેતી મદદનીશ, (ટી-૧૨)

૧	કેન્દ્ર પરના મકાનોની પરચૂરણ રીપેરીંગની કામગીરી.
૨	સ્કેપ ૨જીસ્ટર નિભાવવું.
૩	સ્ટોરને લગતા તમામ રેકૉર્ડ નિભાવવા તથા જાળવણી કરવી. તેમજ ટેડ્સ્ટોકનો ચાર્જ સંભાળી તેને સંલગ્ન તમામ રેકૉર્ડ્સ જાળવવા.
૪	ટ્રેક્ટરની લોગબુક તથા હિસ્ટ્રીસીટ, કલ્ટીવેશન શીટ નિભાવવાની કામગીરી.
૫	મજૂર મસ્ટર તથા ફાર્મની ફેનિક હાજરી ભરવી.
૬	ફાર્મ પર લેવામાં આવતા અખતરાઓ, નિદર્શનો અને બીજ ઉત્પાદનની કામગીરી. ટી-૧૦ નાં માર્ગદર્શન મુજબ કરવી.
૭	ફાર્મની સંપૂર્ણ દેખરેખ.
૮	ફાર્મનો સંપૂર્ણ સ્ટોર ચાર્જ.
૯	કેન્દ્ર તથા યુનિટના વડા વખતોવખત સોંપે તે કામગીરી.

(૧૭) એસ. એમ. સૈયદ, ડ્રાયવર

મુદ્દા નંબર :— ઉ દેખરેખ અને જવાબદારીના માધ્યમ સહિત નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યરીતિઃ— વહીવટી-વ-હિસાબી કર્મચારી / વૈજ્ઞાનિક / નિષ્ણાંત / વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા/ વિસ્તરણ શિક્ષણ નિયામકશી/સંશોધન નિયામકશી / કુલસચિવશી/ કુલપતિશી ડાયરેક્ટરશી, ATARI, પુષે

મુદ્દા નંબર :—૪ પોતાના કાર્યો બજાવવા માટે નકફી કરેલા ધોરણો :—

૧.	ખેડૂતો અને ગ્રામીણ યુવાનો માટે "કાર્ય દ્વારા શિક્ષણ" પર ભાર મુકીને કૃષિ અને સંલગ્ન વિષયો અંગે ટૂકાં તેમજ લાંબાગાળાના વ્યાવસાયિક તાલીમવર્ગો યોજીને સ્વરોજગારી વધારવાનો પ્રયત્ન કરવો.
૨.	નવીન કૃષિ તજ્જીતોઓ અંગે ખેડૂતોના પ્રતિભાવો જાણવા માટે ખેડૂતોના ખેતરો ઉપર વિવિધ પાકોના પ્રથમ હરોળના નિદર્શનો (Front line demonstrations) યોજવા.
૩.	સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ ટકાઉ ખેતી પદ્ધતિઓ વિકસાવવા સારુ નવી બહાર પાડવામાં આવતી કૃષિ તજ્જીતાઓની જુદી જુદી કૃષિ—આબોહવકીય પરિસ્થિતિમાં યોગ્યતા અને અનુકૂળતા ચકાસવા માટે તથા ખેડૂતોને તે પ્રત્યક્ષ બતાવવા માટે ખેડૂતોના ખેતરો પર ક્ષેત્રિય—અખતરા (On-farm trials)નું આયોજન કરવું.
૪.	કૃષિ અને સંલગ્ન વિષયોના સંશોધનો સંબંધી અધ્યતન માહિતી અંગે જે તે કાર્યક્ષેત્ર વિસ્તારના વિસ્તરણ કાર્યકરો/અધિકારીઓને જાણકારી આપીને નવીન તજ્જીતા અંગેના જ્ઞાનમાં વધારો કરવા માટે નિયમિત રીતે તાલીમ કાર્યક્રમો યોજવા.

મુદ્દા નંબર :—૫ કાર્યો બજાવવા માટે પોતાની પાસેના અથવા નિયંત્રણ હેઠળના કે કર્મચારીઓ દ્વારા અનુસરવામાં આવતા નિયમો, વિનિયમો, સૂચનાઓ, નિયમસંગ્રહો અને તે સંબંધી રેકર્ડ :—

કૃષિ યુનિવર્સિટીની સ્ટેચ્યુટરી જોગવાઈઓ મુજબ નિયમો, વિનિયમોઅને સૂચનાઓને અનુસરવામાં આવે છેઠેમજ માન. રાજ્ય સરકારશીના કૃષિ અને સહકાર વિભાગના આદેશો અનુસાર તથા કેન્દ્ર સરકારશીના આઈસીએઆરની માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવે છે તથા હિસાબી કામગીરીનું લોકલ ફંડ ઓડીટરશી દ્વારા ઓડીટ કરાવવામાં આવે છે. તેમજ અત્રેની એકમ દ્વારા જરૂરી રજીસ્ટરો નિભાવવામાં આવે છે જેવા કે, ટેડ્સ્ટોક, સ્ટોર રોજમેળ, ચીજવસ્તુ વપરાશ, મંજૂરી, લેબરસીટ, હાજરીપત્રક, રીપેરીગ, સાધનોની લોગબુક, વાહનની લોગબુક અને હીસ્ટ્રીસીટ, નમૂના રજીસ્ટર, પરચૂરણ રજા, ટપાલ આવક જાવક તથા હિસાબી રજીસ્ટરો જેવા કે કેસબુક, રસીદ બુક, માસિક ખર્ચ પત્રક રજીસ્ટર વિગેરે રેકર્ડની નિભાવણી કરવામાં આવે છે.

મુદ્દા નંબર :—૬ પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દરસ્તાવેજોની કક્ષા અને વર્ગીકરણનું પત્રક :—

ટેબલ ફાળવણી	દરસ્તાવેજોની કક્ષા
ડૉ. વી. કે. પોશીયા વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા (ઇ.ચા.)	ખાનગી અહેવાલની ફાઈલ.
ડૉ. વી. કે. પોશીયા	<ul style="list-style-type: none"> ➢ આઈસીએઆર સાથેના પત્ર વ્યવહાર ની ફાઈલ, QPR, MPR, APR, Action Plan, વૈજ્ઞાનિક સલાહકાર સમિતીફાઈલ, ઝક, ZREARC, AGRESCO Report OF., Training & Extension Activity સ્લાઇડ. ➢ આદિવાસી મહિલા તાલીમ કેન્દ્રની તાલીમ, નિર્દર્શનો અને વિસ્તરણને લગતી ફાઈલો, યોજનાકીય ખરીદી, વપરાશ, તથા અન્ય રજીસ્ટરો, તથા ફર્મસે હોસ્ટેલના રેકર્ડ, મધમાખી પાલન નિર્દર્શન યુનિટ, તથા ગંગામા મોડલ યુનિટ, ફાઈલ. ➢ પાક ઉત્પાદન વિષય સબંધિત ફાઈલો, સીડ વીલેજ, ટી.એસ.પી, આરકેવીવાય પત્રવ્યવહાર, પાક સરકાર વિષય સબંધિત ફાઈલો, NFSM-NMOOP, NRCG -DGR, SEED, TSP Castor, ASCI, મશરૂમ યુનિટ, વર્મી કોમ્પોસ્ટ યુનિટ.
ડૉ. ડી. બી. ભીસરા	<ul style="list-style-type: none"> ➢ પશુપાલન વિષય સબંધિત ફાઈલો, બાયોગેસ યુનિટ, અઝોલા યુનિટ તેમજ બકરા યુનિટની ફાઈલ. ➢ બાગાયત વિષય સબંધિત ફાઈલો, એન.એચ.એમ.પત્રવ્યવહાર.
ડૉ. એમ. વી. તિવારી	ગૃહ વિજ્ઞાન વિષય સબંધિત ફાઈલો, લાઈબ્રેરી પત્રવ્યવહાર, એડપ્ટીવ યોજના પત્રવ્યવહાર, બજાના ફાઈબર, સ્વચ્છતા અભિયાન, Farmer Doubling Income,

	MULLARP TSP file.
શ્રી. એમ. એલ. વિસાત	કેવીકેની પાક યોજનાઓ, ફર્મને લગતી તમામ ફાઈલો તથા પત્રવ્યવહારની ફાઈલ, બાંધકામને લગતી ફાઈલો, ટેડ સ્ટોક, ફર્મ રેકૉર્ડ, સ્કેપ રજીસ્ટર, ટ્રેક્ટરની લોગબુક તથા હિસ્ટ્રીસીટ, કલ્ટીવેશન શીટ, સ્ટોર ખાતાવહી, સ્ટોર રોજમેળ, ચીજવસ્તુ વપરાશ રજીસ્ટર, પરચુરણ રજીસ્ટર.
શ્રી. વી. આર. જીજાળા	સ્ટોર રોજમેળ, KVK (2704-03) સિકમના રજીસ્ટર, સ્ટોર ખાતાવહી, સ્ટોર રોજમેળ, ચીજવસ્તુ વપરાશ રજીસ્ટર, પરચુરણ રજીસ્ટર, ભોજનબીલ રજીસ્ટર KVK (2704-03) તથા STL ને લગતી ફાઈલો, KVK (2704-03) ખરીદીની ફાઈલો, KVK (2704-03) બાંધકામને લગતી ફાઈલો.
શ્રી. એન. જે. વ્યાસ (પુલના ધોરણો – COA, ભરુય)	કંયેરી સંલગ્ન તમામ વહિવટ તથા હિસાબી રેકૉર્ડસ, પે બીલ ફાઈલ, તમામ કર્મચારીઓની સર્વિસ બુક, પર્સનલ પી.એફ./ સી.પી. એફ.બુક/ ફાઈલો તથા સી.આર.ના રેકૉર્ડસ રાખવા. નોંધ-સદર કામગીરી શ્રી. જે. ડી. ચૌધરી, જુનીયર કલાર્ક હબભત, દેઝિયાપાડાને (પુલના ધોરણો કે.વિ.કે., દેઝિયાપાડા) સોપવામાં આવેલ છે.
શ્રી. એમ. એચ. ભડ્ક (પુલના ધોરણો – આઈટી સેલ નવસારી)	સદર કામગીરી વી. આર. જીજાળા, ટ્રેનિંગ આસિસ્ટન્ટ દ્વારા કરવામાં આવશે.

મુદ્દા નંબર :—૭ પોતાની કે સત્તામંડળો અનુસરવાની નીતિ અથવા અમલીકરણતેના સંબંધમાનાગરિકો સાથે વિચારવિનિમય માટે અથવા તેમના દ્વારા રજુઆત માટેની વિધમાન ગોઠવણાનીવિગતો :—

ગામના લોકોને સહભાગી બનાવીશ્રસ્ટ એરીયા નક્કી કરી તે પ્રમાણે ખેતી, પશુપાલન અને ગૃહ વિજ્ઞાન વિષયક તાલીમો તથા વિસ્તરણ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.

મુદ્દા નંબર :—૮ તેના ભાગ તરીકે અથવા તેની સલાહના હેતુ માટે બે અથવા તેથી વધુ વ્યક્તિત્વોના બનેલા બોર્ડ, કાઉન્સિલ, સમિતિ અને બીજા મંડળોની બેઠકો લોકો માટે ખુલ્લી છે કે કેમ અથવા તેવી બેઠકોની કાર્યનોંધો લોકોને મળવાપાત્ર છે કે કેમ :—

વૈજ્ઞાનિક સલાહકાર સમિતિ બનાવવામાં આવેલ છે. જેમાં જીલ્લાના સમગ્ર વિભાગો, સહકારી સંસ્થાઓ, પ્રગતિશીલ ખેડૂતો નક્કી કરવામાં આવે છે. જેમાં અમુક સમયે ફેરફાર કરી શકાય છે. ફક્ત આ સમ્યશ્રીઓ જ ભાગ લઈ શકતા હોઈ સામાન્ય નાગરિક માટે તેમાં પ્રવેશ નથી.

વैज्ञानिक सलाहकार समितिना अधिकारीओ/ कर्मचारीओनी माहिती

अ.नं.	होदो	सभ्य
१	કુલપતિશ્રી, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી	યેરમેન
૨	જોનલ પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી, અટારી, પુના	સભ્ય
૩	વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ન.કૃ.યુ, નવસારી	સભ્ય
૪	સંશોધન વैજ્ઞાનિક, કેન્દ્રીય જમીન ખારાશ સંશોધન સંસ્થા, યહબચ, મકતમપુર, ભરૂચ.	સભ્ય
૫	સહ પ્રાધ્યાપકશ્રી (એગ્રોનોમી), કોલેજ ઓફ એશ્રીકલ્યર, ભરૂચ	સભ્ય
૬	મદદનીશ પ્રાધ્યાપકશ્રી (બાગાયત), કોલેજ ઓફ એશ્રીકલ્યર, ભરૂચ	સભ્ય
૭	મદદનીશ પ્રાધ્યાપકશ્રી, (પશુપાલન) કોલેજ ઓફ એશ્રીકલ્યર, ભરૂચ	સભ્ય
૮	DPD, ATMA, નર્મદા	સભ્ય
૯	ડી.ડી.એમ., નાબાઈ બેંક, નર્મદા	સભ્ય
૧૦	જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, નર્મદા	સભ્ય
૧૧	નાયબ બાગાયત અધિકારીશ્રી, નર્મદા	સભ્ય
૧૨	ડિસ્ટ્રીક્ટ ઓફિસિલ, ઓન્ઝિનીયરીગ ઓફિસર, નર્મદા	સભ્ય
૧૩	નાયબ પશુપાલન નિયામકશ્રી, નર્મદા	સભ્ય
૧૪	મદદનીશ સુપ્રિટેટ, ફિશરીજ ઇપાર્ટમેન્ટ, નર્મદા	સભ્ય
૧૫	શ્રી ગોવિંદભાઈ ડી. વસાવા, પ્રગતી શીલ મહીલા ખેડુત	સભ્ય
૧૬	શ્રીમતિ રંજનબેન આર. વસાવા, પ્રગતી શીલ મહીલા ખેડુત	સભ્ય
૧૭	શ્રીમતિ મનીષાબેન એ. વસાવા, પ્રગતી શીલ મહીલા ખેડુત	સભ્ય
૧૮	શ્રી રાજેશભાઈ એન. વસાવા, પ્રગતી શીલ ખેડુત	સભ્ય
૧૯	ડૉ. વી. કે. પોશીયા, વરિષ્ઠ વैજ્ઞાનિક અને વડાશ્રી (ઈ.ચા.), કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેઢિયાપાડા	સભ્ય
૨૦	કેવિકેનાં વૈજ્ઞાનિકો, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેઢિયાપાડા	સભ્ય

મુદ્દા નંબર : -૮ સ્ટાફની માહિતી:-

ક્રમ	કર્મચારી/ અધિકારીનું નામ	હોદો
૧	ડૉ. વી. કે. પોશીયા	વરિષ્ઠ વैજ્ઞાનિક અને વડા (ઈ.ચા.)
૨	પ્રો. વી. કે. પોશીયા	મદદનીશ પ્રાધ્યાપક (TWTC)
૩	ડૉ. શૈલેષ્ઠકુમાર એન. ગજજર, (પુલના ધોરણે - કોલેજ ઓફ ફોરેસ્ટ્રી, નવસારી)	વैજ્ઞાનિક (પાક સંરક્ષણ)
૪	ડૉ. એમ. વી. તિવારી	વैજ્ઞાનિક(ગૃહ વિજ્ઞાન)
૫	ડૉ. ડી. બી. ભીસરા	વैજ્ઞાનિક(પશુ પાલન)

૬	શ્રી. એમ. એલ. વિસાત ભરુચ	ફાર્મ મેનેજર
૭	શ્રી. વી. આર. જીજાળા	ટ્રેનિંગ આસિસ્ટન્ટ
૮	શ્રી. એમ. એચ. ભડ્ક (પુલના ધોરણે - આઈટી સેલ નવસારી)	કોમ્પ્યુટર પ્રોગ્રામર
૯	શ્રી અન. જે. વાસ (પુલના ધોરણે - COA, ભરુચ)	કચેરી અધિક્ષક
૧૦	શ્રી. એસ. એમ. સૈયદ	ડ્રાઇવર કમ મેકેનિક

મુદ્દા નંબર :—૧૦ તો વિનિયમોમાં જોગવાઈ કર્યા પ્રમાણે વળતરની પદ્ધતિ સહિત તેના દરેક અધિકારીઓ અને કર્મચારીઓને મળતાં માસિક મળતરની વિગતો:-

ક્રમ	કર્મચારી/ અધિકારીનું નામ	હોદ્દો	પગાર ધોરણ	પગાર	ગ્રોસ પે
૧	ડૉ. વી. કે. પોશીયા	વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા (ઈ.ચા.)	-	-	-
૨	ડૉ. વી. કે. પોશીયા	મદદનીશ પ્રાધ્યાપક (TWTC)	૫૭૭૦૦- ૧૮૨૪૦૦	૭૫,૨૦૦/-	૧,૧૬,૮૦૮/-
૩	ડૉ. શૈલેષ્ઠકુમાર અન. ગજજર	વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ)	૭૮૮૦૦- ૨૧૧૪૦૦	૮૫,૪૦૦/-	૧,૪૭,૮૧૬/-
૪	ડૉ. એમ. વી. તિવારી	વૈજ્ઞાનિક (ગૃહ વિજ્ઞાન)	૫૭૭૦૦- ૧૮૨૪૦૦	૭૩,૦૦૦/-	૧,૦૭,૫૮૦/-
૫	ડૉ. ડી. બી. ભીસરા	વૈજ્ઞાનિક (પણુ પાલન)	૫૭૭૦૦- ૧૮૨૪૦૦	૬૪,૬૦૦/- + ૬૦૮૦/- (NPP)	૧,૦૮,૮૨૩/-
૬	શ્રી. એમ. એલ. વિસાત	ફાર્મ મેનેજર	૩૮૬૦૦- ૧૨૬૬૦૦	૩૮૬૦૦/-	૫૮,૨૫૪/-
૭	શ્રી. વી. આર. જીજાળા	ટ્રેનિંગ આસિસ્ટન્ટ	૩૮૬૦૦- ૧૨૬૬૦૦	૪૩,૬૦૦/-	૬૪,૬૫૬/-
૮	શ્રી. એમ. એચ. ભડ્ક	કોમ્પ્યુટર પ્રોગ્રામર	૩૮૬૦૦- ૧૨૬૬૦૦	૪૩,૬૦૦/-	૬૮,૧૪૪/-
૯	શ્રી. અન. જે. વાસ	કચેરી અધિક્ષક	૩૪૪૦૦- ૧૧૨૪૦૦	૩૮,૬૦૦/-	૬૬,૦૪૬/-
૧૦	શ્રી. એસ. એમ. સૈયદ	ડ્રાઇવર કમ મેકેનિક	૨૧૭૦૦- ૬૫૧૦૦	૨૮,૩૦૦/-	૪૩,૮૩૮/-

મુદ્રા નંબર :—૧૧ તમામ યોજનાઓ, સુચિત ખર્ચ અને કરેલી વહેંચણી પરના અહેવાલોની વિગતો દર્શાવતી તથા તે દરેક એજન્સીને ફાળવેલ નાણાંકીય સંસાધનોની વિગતો :—

અ.ન	બજેટ સદર	યોજનાનું નામ	યોજનાનો પ્રકાર	સુચિત ખર્ચ
૧.	૨૭૦૪-૦૩	કે.વિ.કે., ટેડિયાપાડા	આઈ.સી.એ.આર.	૧૪,૨૩,૬૫૦.૦૦
૨.	૨૦૭૬-૨૦	કે.વિ.કે. રીવોલ્વોગ ફંડ એકાઉન્ટ	કે.વિ.કે. રીવોલ્વોગ ફંડ	૧૬,૮૮,૭૬૪.૦૦
૩.	૧૨૦૪૭	કૃષિ સંશોધન યોજના	ગુજરાત સરકાર	૨૮,૧૫,૫૧૧.૦૦
૪.	૧૨૮૪૬-(અ)	નીચ કોપ યોજના	આઈ.સી.એ.આર.	૩,૦૦,૦૦૦.૦૦
૫.	૧૨૮૪૬-(સી)	નીચ કોપ યોજના	આઈ.સી.એ.આર.	૩,૦૦,૦૦૦.૦૦
૬.	૧૨૮૪૬-(ડી)	નીચ કોપ યોજના	આઈ.સી.એ.આર.	૨,૪૮,૮૮૮.૦૦
૭.	૧૨૩૦૬-(થી)	એડેપ્ટીવ ટ્રાઇલ	આઈ.સી.એ.આર.	૧૧,૨૫,૦૦૦.૦૦
૮.	૧૨૩૦૭	સ્ટ્રોન્ઘનીગ ટ્રાયબલ વુમન ટ્રેનીંગ સેન્ટર- ફેઝ : ૨	ગુજરાત સરકાર	૩૩,૪૪,૦૨૭.૦૦
૯.	૨૦૬૭	ટીએસ્પી	આઈ.સી.એ.આર.	૩૮,૮૦૦.૦૦
૧૦.	૨૧૦૫-એ	Cluster FLD on Pulses funded under NFSM during 2017-18	આઈ.સી.એ.આર.	૩,૧૨,૫૧૪.૦૦
૧૧.	૨૧૦૬-બી	Cluster FLD on Oilseeds funded under NMOOP during 2017-18	આઈ.સી.એ.આર.	૪,૮૮,૨૫૧.૦૦
૧૨.	૦૨૧૧૩-૦૧	RKVY-ASCI Scheme 2018-19	આઈ.સી.એ.આર.	૫૨,૮૧૪.૦૦
૧૩.	૦૨૧૨૧-૦૧	Atmosphere & Climate Research (ACROSS) DAMU	આઈ.સી.એ.આર.	૧૩,૮૪,૦૨૫.૦૦
૧૪.	૨૧૩૨-૦૨	Microbial-based Agricultural Waste Management Using Vermi composting under (SAP)	આઈ.સી.એ.આર.	૨૪,૩૮૦.૦૦
૧૫.	૨૧૪૧	NICRA	આઈ.સી.એ.આર.	૧૦,૨૬,૪૭૫.૦૦
૧૭.	૨૧૪૩	FPO	આઈ.સી.એ.આર.	૧,૦૬,૮૭૯.૦૦
૧૮.	૨૧૪૪	NFSM- IRM - PBWM	આઈ.સી.એ.આર.	૧,૭૮,૦૪૬.૦૦
૧૯.	૨૧૪૮-૦૩	Natural farming	આઈ.સી.એ.આર.	૪,૬૮,૩૦૦.૦૦

મુદ્રા નંબર : - ૧૨ ફાળવેલી રકમો અને તેવા કાર્યક્રમોના લાભાર્થીઓની વિગતો સહિત આર્થિક સહાય કાર્યક્રમોની અમલબજ્વણીની રીત : - આર્થિક સહાય આપવામાં આવતી નથી. પરંતુ FLD અંતર્ગત ઈનપુટ્સ આપવામાં આવે છે.

મુદ્રા નંબર : - ૧૩ છુટછાટો, પરવાનગીઓ અથવા અધિકૃતિઓ મેળવનારાની વિગતો : - લાગુ પડતું નથી.

મુદ્રા નંબર : - ૧૪ ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં ઉપલબ્ધ અથવા ધરાવેલી માહિતીને લગતી વિગતો : - નવસારી કૃષિ યુનિવર્સિટીની વેબસાઈટ www.nau.inપર મુકવામાં આવેલ છે.

મુદ્રા નંબર : - ૧૫ જાહેર ઉપયોગ માટે નિભાવવામાં આવતા હોય તેવા ગ્રંથાલય અથવા તેવા વાંચનલયના કામકાજના કલાકો સહિતનીમાહિતી તથા તે મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સુવિધાઓનીવિગતો : - અતેની કચેરી ખાતે નાગરીકો માટે ઉપલબ્ધ નથી.

મુદ્રા નંબર : - ૧૬ જાહેર માહિતી અધિકારીઓના નામો, હોદાઓ અને બીજી વિગતો ?

ડૉ. વી. કે. પોશીયા	
જાહેર માહિતી અધિકારી અને વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાશ્રી (ઇ.ચા.), કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી દેસ્ટિયાપાડા, જી. નર્મદા, પીન નં. ૩૮૩૦૪૦ (ગુજરાત)	
ટેલીફોન નંબર	
ઓફિસ	૦૨૬૪૮ - ૨૩૪૫૦૧
મોબાઇલ	૯૮૮૮૨૧૧૬૨૮
રહેઠાડા	૯૮૮૮૨૧૧૬૨૮
ફેક્સ	૦૨૬૪૮ - ૨૩૪૫૦૧
E-mail	kvkdediapada@nau.in

મુદ્રા નંબર : - ૧૭ ઠરાવવામાં આવે તેવી બીજી માહિતી પ્રસિદ્ધ કરવી જોઈશે અને ત્યારપણી દર વર્ષે આ પ્રકાશનોને અધતન કરવા જોઈશે. - હા.

- અલગથી નિભાવવાના થતા રજીસ્ટર

ક્રમ. નં.	રજીસ્ટર	રજીસ્ટર નિભાવનાર કર્મચારી/ અધિકારીનું નામ
૧	જે.આર.એફ./એસઆરએ/આર.એ/રોજમદારાનાં કોન્ટ્રાક્ચ્યુઅલ રજીસ્ટર	ડૉ. એમ. વી. તિવારી, વૈજ્ઞાનિક (ગૃહ વિજ્ઞાન), ડૉ. વી. કે. પોશીયા,
૨	રીસર્ચ પેપર રજીસ્ટર	મદનીશ પ્રાધ્યાપક (TWTC), શ્રી.

૩	ભલામણ કરેલ તેનું રજીસ્ટર	અમ. એલ. વિસાત, ફાર્મ મેનેજર
૪	સેમીનાર/સીમ્પોઝીયમ/કોન્ફરન્સ/વર્કશોપ/શૉટ ટ્રેનીંગ/સમર એન્ડ વિન્ટર સ્કુલ ટ્રેનીંગ/સમર એન્ડ વિન્ટર સ્કુલ ટ્રેનીંગ ઓરીએન્ટેશન ટ્રેનીંગ/રીફેસર કોર્ષ/અન્ય કોર્ષ માટેનું રજીસ્ટર/ઓથ. રીફીકેશન રજીસ્ટર	શ્રી. વી. આર. જીજાળા, ટ્રેનિંગ આસિસ્ટન્ટ
૫	દરેક પાકની GAP (ગુડ એગ્રીક્લ્યુર પ્રેક્ટાઇસિસ)	શ્રી. અમ. એલ. વિસાત, ફાર્મ મેનેજર.
૬	જે તે ફાર્મની વિગતો નકશા વિ. જમીન/પાકનું પૂછ્યકરણ (વર્ષ વાર)	

કચેરીનો સમય નીચે મુજબ છે :

(૧) વહિવટી કર્મચારીઓ માટે : સવારે ૧૦-૩૦ થી સાંજના ૧૮-૧૦ સુધી

રિસેષ સમય : ૧૪-૦૦ થી ૧૪-૩૦

(૨) શિક્ષક અને કર્મચારીઓ માટે : સવારે ૦૮-૦૦ થી સાંજના ૧૨-૦૦ અને

બપોરે : ૧૪-૦૦ થી ૧૭-૧૦ (કોલેજો માટે)

બપોરે : ૧૪-૩૦ થી ૧૮-૧૦ (અન્ય કચેરીઓ માટે)

રિસેષ સમય : ૧૨-૦૦ થી ૧૪-૦૦

જાહેર માહિતીઅધિકારી અને
વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાશ્રી
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન. કૃ. યુ.,
દેઢીયાપાડા

એનેક્ષર - એ

(સામાન્ય વહીવટ વિભાગના તા.૦૧/૦૫/૨૦૦૮ ના પરિપત્ર ક્રમાંક: પીએડી-૧૦-૨૦૦૭
-૩૩૫૩૬૪ આટીઆઈ સેલનું બિડાશ)

પ્રમાણપત્ર

આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે માહિતી અધિકારી અધિનિયમની કલમ-૪ અંતર્ગત સ્વયં જાહેર કરવાની બાબતો (પ્રોઓફિચલ ડિસ્કલોઝર) (P.A.D.) મારા વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. અને તા.૦૧/૦૫/૨૦૨૪ની સ્થિતિએ વડી કચેરીની મંજુરી મેળવી અધતન કરવામાં આવેલ છે.

તા.૦૧/૦૫/૨૦૨૪

જાહેર માહિતી અધિકારી અને
વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાશ્રી
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.યુ.,
દેડીયાપાડા

અનેક્ષર - બી

(સામાન્ય વહીવટ વિભાગના તા.૦૧/૦૫/૨૦૦૯ ના પરિપત્ર ક્રમાંક: પીઓડી-૧૦-૨૦૦૯
-૩૩૫૩૬૪ આટીઆઈ સેલનું બિડાષ)

પ્રમાણપત્ર

આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે માહિતી અધિકારી અધિનિયમની કલમ-૪ અંતર્ગત સ્વયં જાહેર કરવાની બાબતો (પ્રોએક્ટીવ ડિસ્કલોઝર) (P.A.D.) મારા વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. અને તા.૦૧/૦૫/૨૦૨૪ની સ્થિતિએ અમારી મંજુરી મેળવી અધતન કરવામાં આવેલ છે.

તા.૦૧/૦૫/૨૦૨૪

—૪૮૫૬૨
જાહેર માહિતી અધિકારી અને
વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાશ્રી
કૃષ્ણ વિજાન કેન્દ્ર, ન.કૃ.યુ.,
દેઢીયાપાડા

અપીલ. સટોઅધિકારી
અને
વિસ્તરણ શિક્ષણ નિયામક